

શ્રી બાલાસિનોર નવયુવક સંઘ પ્રકાશિત



જ્યોતિ પુંજ

ડીસેમ્બર' ૨૦૦૩

મૃત્યુ ઘોટલે મુક્તિ

જીવન અને મૃત્યુ એ પરમાત્માની એક મહાન ભેટ છે. જેમ જીવન કોઈની ઈચ્છાથી નહી, પરંતુ જગતનાં સર્જનહારની દેણ છે તેમજ મૃત્યુ વિષે જાણવું. ઈશ્વરે આ બે બાબત માત્ર પોતાના જ હાથમાં રાખી છે, હજુય રાખી છે. અતિ આધુનિક ને આશ્ચર્યકારક શોધો કરી શકનાર કોઈ મહાવૈજ્ઞાનિક પણ આ બે બાબત હજુય હસ્તગત કરી શક્યો નથી અને તેથી જ આપણે સ્વીકારીએ છીએ કે પ્રભુની આ લીલા ખરેખર અકળ છે. વળી જીવન અને મૃત્યુ બન્ને સ્વાભાવિક છે, કળાનુક્રમે

થતી કુદરતી આવસ્થા છે અને તેથી આ કુદરતી ક્રિયાના પરિચયથી કે પરિણામથી આપણે અતિ હર્ષ કે મહાશોક કરીએ છીએ તે બહુ ઉચિત નથી. જોકે અન્ય પ્રાણીઓ કરતા આપણે માનવીને આ બન્ને અવસ્થા વધુ સ્પર્શ છે. કારણ કે અન્ય જીવો કરતા માનવી બુદ્ધિશાળી અને વિચારશીલ પ્રાણી છે. એમ કહોને વધુ લાગણીશીલ પ્રાણી છે.

- સંકલન

શ્રી વાડાસિનોર દશાનીમા નવયુવક મંડળ અને

શ્રી વાડાસિનોર દશાનીમા નવયુવક મંડળ મેડીકલ ટ્રસ્ટ

સહર્ષ ઉજવે છે

૭૫ વર્ષનો તથા ૨૫ વર્ષનો

ઉજવણી પર્વ

તા. ૨૨-૨-૦૪ રવિવાર સવારે ૯-૦૦ કલાકે
બીરલા માતૃશ્રી સભાગૃહ, મરીનલાઈન્સ, મુંબઈ-૪૦૦ ૦૦૨

:- મ્યુઝીકલ ઓરકેસ્ટ્રા :-

આ દિવસે સ્મરણીકાનું વિમોચન, મંડળના અત્યાર સુધી થઈ ગયેલા અને હયાત પ્રેસીડન્ટોનું બહુમાન, ટ્રસ્ટના હયાત સુપીન્ટેન્ડરોનું બહુમાન તથા મેમ્બરો માટે જમણાવાર જમણાવાર : ૧૨-૩૦ કલાકથી સુદંરાબડાઈ હોલ, મરીનલાઈન્સ ખાતે જમણાવારમાં આવનાર વ્યક્તિએ રૂ.૧૦૦/- અંકે રૂપિયા એકસો નીચેના કોઈપણ સ્થળે ભરવાના રહેશે.

૧) શ્રી વાડાસિનોર દ.ન.મં. મેડીકલ ટ્રસ્ટ કાર્યાલય
મહેતા હાઉસ, ભારતી વિદ્યાભવનની સામે, ચોપાટી, મુંબઈ-૦૭ (સમય દરમ્યાન)

૨) શ્રી યોગેશ આર. ધારીયા
ક્રીસ્ટન્ટ ઈલેક્ટ્રીકલ્સ, બોટાવાલા બીલ્ડીંગ, ૪૭૫ કાલબાદેવી રોડ, મુંબઈ-૦૨

૩) શ્રી સુરેન્દ્ર આર. મોદી
સુરેન્દ્ર ટ્રેડીંગ કંપની, ૧૨૯, નારાયણ, ધ્રુવ સ્ટ્રીટ, મુંબઈ-૦૩

શ્રી રસીકલાલ આર. કડકીઆ

(પ્રમુખ)

શ્રી મોહન પરીખ

કન્વીનર સિનીયર સમિતિ

શ્રી રજનીકાંત કે. કડકીઆ(ધરીવાળા)

કન્વીનર ભંડોળ સમિતિ

શ્રી રજનીકાંત કે. કડકીઆ (લટકારી)

કન્વીનર વહીવટી સમિતિ


શ્રી જતીન ન. દેસાઈ

(મંત્રીઓ) સંયોજક પ્રોગ્રામ સમિતિ

શ્રી યોગેશ આર. ધારીઆ

(મંત્રીઓ) સંયોજક પ્રોગ્રામ સમિતિ

જ્યોતિ પુંજ



તંત્રી સ્થાનેથી

એક અતિવૃદ્ધ માજી સાથે વાતો કરતો હતો. આમ પણ વૃદ્ધોને કોક સાંભળવાવાળું મળે તો ભુતકાળ યાદ કરવાની અને એમના જમાનાની વાતોને વાગોળવાની ખુબ જ ગમતી હોય છે. વાતવાતમાં ખાવાની અને ઘરની વાતો નીકળી. મેં પુછ્યું, “મા, તારા જમાનામાં તો શાકને ફળફળાદી આવતાં જતાં રસ્તામાંથી તોડતા હશે નહીં? તો કહે ભાઈલા શાકભાજી તો ત્યારે ભાગ્યેજ કોઈ ખાતું. રોટલો, દાળ, ભાત, છાસ, દુધ બસ આજ અમારો મુખ્ય ખોરાક. એમની પાસે નાનકડું ખેતર, બે ગાયો, નાનકડું માટીવાળું ઘર, ઘરમાં માટીનો ચુલો, સુવા માટે થોડા ગોદડાં, બે સાડલાં, બે-ચાર ઘડા. કપડા ધોવાનું તગારું અને ધોકો અને થોડી ઘરવખરી. આટલી જ એમની જરૂરિયાત કહો કે લકઝરી.. ક્યારેય પગમાં ચંપલ નથી પહેર્યા છતાં પણ એ દિવસોને યાદ કરતાં માજીના બોખા મોંમાં જે હાસ્ય અને એમની ઉંડી ઉતરી ગયેલી આંખોમાં મને જે સંતોષ દેખાયો એ આજના જમાનામાં તો દુર્લભ જ છે.

ત્યારે અને આજથી ૧૦-૨૦ વર્ષો પહેલાં સુધી પણ આપણે ભલે આગળ વધ્યા, પણ આપણી જરૂરિયાતો ખુબ જ ઓછી હતી. પણ ધીરે ધીરે ખુબ જ પ્લાનીંગથી પશ્ચિમના દેશોની કંપનીઓનું આપણાં ઉપર રીતસરનું આક્રમણ શરૂ થયું. આપણા દેશના દરવાજા ગ્લોબાઈઝેશનના નામે ખુલ્લા મુક્યાં. ટેકનોલોજી તો આવી, પણ ૧૦૦ કરોડની વસ્તી જોઈને મલ્ટીનેશનલ કંપનીઓના મોઢામાં પાણી આવ્યું અને આક્રમણ શરૂ.

વર્ષ	અંક	તારીખ
૪૪	૯	૧૪-૧૨ -૨૦૦૩
નિખિલ પરીખ (તંત્રી) જતીન ન. દેસાઈ ચેતન કાં. મોદી શ્રીમતી શીટા મુ. ગાંધી (S.E.O.) નિકેશ જ. ગાંધી પત્રવ્યવહારનું સરનામું નિખિલ પરીખ (ફોન : ૨૩૮૨ ૨૫ ૧૦) વીલચીન કોમર્શીયલ કોરપોરેશન ૬, ખોખા બજાર, મુંબઈ-૪૦૦ ૦૦૩. ફોન : ૨૪૪૪ ૯૯૧૬ • ૨૪૪૪ ૯૯૨૯ * મંત્રી : પ્રદીપ કડકીઆ ચંદ્રેશ એન્ટરપ્રાઈસ કોરપોરેશન, ૧૭, દેવકરણ મેન્શન, પાઠક વાડી, લોહાર ચાલ, મુંબઈ- ૪૦૦ ૦૦૨. ટે.(ઓ.) : ૨૨૦૧૮૩૨૬/૨૨૦૬૧૯૩૫ (ઘર) : ૨૩૮૬૫૭૬૯ (મોબાઈલ) : ૯૮૧૯૩૮૯૪૮ * : કાર્યાલય : ૧૧૮/૧૨૦, અરદેશરદાદી સ્ટ્રીટ, વી.પી. રોડ, મુંબઈ - ૪૦૦ ૦૦૪. ટે.નં. : ૨૩૮૮૭૦૦૬ : સમય : સોમવાર થી શનિવાર ૭ થી ૮.૩૦ (સાંજે) રવિવાર ૯.૩૦ થી ૧૧.૦૦ (સવારે) visit us at www.balasinor.org		

આટલી ઓછી જરૂરિયાત? તમે તો પછાત કહેવાઓ, જુઓ અમે શું વાપરીએ છીએ અને કેવી રીતે જીવીએ છીએ. ટી.વી. તો હતાં જ, એ લોકોએ ચેનલો ખરીદી લીધી અને જાહેરાતનો બોમ્બમારો શરૂ. ધોકો છોડો વોર્શીંગ મશીનો લાવો. અમારો સાબુ વાપરો અને જુઓ સફેદીનો ચમત્કાર (રંગીન પણ સફેદ, કપડાં સાથે ખીસા પણ સાફ ફીમાં) હવાઈ ચંપલ અને એરશૂઝ, માટલાં છોડો ફીલ્ટર અને કુલરનું પાણી પીઓ. બહાર જાઓ તો બાટલીઓનું પાણી પીઓ (એક લીટર પાણીના ૧૦ પૈસા જાહેરાતને બાટલીનાં રૂ. ૧૨/-) અરે પાણી શું કામ પીવાનું આટઆટલાં ઠંડા પીણા છે. (૧૦ કરોડ ઠંડા પીણાની બાટલીનું માર્કેટ જાહેરખબરો દ્વારા દસ થી વીસ ગણું વધી ગયું છે.) ટી.વી તો હતાં જ. કલર ટી.વી. આવ્યા, ન્યુડીઝીટલ ટી.વી. ચેનલો, બુસ્ટરો વીડીઓ મલ્ટીમીડીઆ, કોમ્યુટરો, વીડીઓ ગેમ, કબાટ જેવડા ફીઝ અને હથેળીમાં સમાય એવડા ફોન, મ્યુઝીક સીસ્ટમો, સી.ડી., નવી ગાડીઓ, રોજ ફેશનના દુનિયાની મશહુર બ્રાન્ડ તેમના કપડાં, છોકરાઓના રમકડા અને ચોકલેટો....અનંત વસ્તુઓનો ખડકલો આપણે ત્યાં થઈ ગયો. જાહેરાતો દ્વારા આપણા અને છોકરાઓના મનમાં ઠસાવવામાં આવ્યું કે આ બધી જરૂરિયાતો કહેવાય શોખ નહીં. તો શોખ કોને કહેવાય?

એનો જવાબ પણ અમારી પાસે છે. ઉપરની બધી વસ્તુઓતો સામાન્ય માણસ પણ ખરીદે છે. તમારા સ્ટેટસનું શું? તમારા માટે ૪૦ લાખની ગાડી છે. ત્રણ ડોરવાળું ૭૫ હજારનું ફીઝ છે. સોનીના ત્રણ લાખના ટી.વી. છે. મોબાઈલ ફોન છે તો એનું સોનાનું કવર કરાવો. કપડામાં પણ ડીઝાઈનર કલોથ હાજર છે. બોલો કેટલાં ખરચવાં છે. ૫૦ હજારથી ૧૦ લાખના ડ્રેસ હાજર છે. ઘડિયાળો પણ સમાન્ય શું કામ? લાખથી પાંચ લાખ અને બે કરોડની પણ ઘડિયાળ હાજર છે. સામાન્ય માણસોને તો ઠીક પણ પૈસાદાર માણસોને પણ

અસંતોષ કરાવે એવી વસ્તુઓ પાછળ માણસોએ રીતસરની દોટ મુકી છે. આ દોટ આપણને ક્યાં લઈ જઈ રહી છે એનો વિચાર કર્યો છે? ‘આસ્થા’ પીકચર જેવું હોય તેવું પણ છોકરીના સાતસો રૂપિયાના બુટ માટે એક સ્ત્રી કેવા ચક્કરમાં પડી જાય છે એનો વિચાર કરવા જેવો છે. આજે નાની કે મોટી સોસાયટીઓમાં કોલેજોમાં દેખાદેખી અને વધતી જરૂરિયાતોને પહોંચી વળવા ઘણી સ્ત્રીઓએ આ માર્ગ અપનાવી લીધો છે. યુવાનો અને પુરુષો પણ જલ્દી પૈસા મેળવવાની લાલચમાં કેટલાંય આડા ધંધાઓ કરવા મંડી પડ્યા છે. અને આ બધું કર્યા પછી દુનિયાભરની મોંઘી ચીજવસ્તુઓ આપણા ઘરમાં આવી ગયા છતાં પણ શું આપણે સુખી છીએ? સાંભળ્યા પણ નહોતા એવા એવા માનસિક અને શારિરિક રોગોના આપણે શિકાર બન્યા છીએ. નર્વસ બ્રેકડાઉન, હાયપરટેન્શન, તાણ વચ્ચે આપણે જીવીએ છીએ. જુવાન જોધ છોકરાઓને હાર્ટએટેક, બ્લડપ્રેશર, ડાયાબીટીસ સામાન્ય થતું જાય છે. પણ આ બધું આપણને જરૂરિયાતો મેળવવા માટેની દોટમાં અટકાવી શકે એમ નથી. રોજ નવી વસ્તુઓ આવતી જાય છે અને એ મેળવવા, બીજાથી વધારે આગળ નીકળી જવા આપણે દોડતાં જ રહેવાનું છે. વિજેતાઓ શું મેળવશે એ તો એક પ્રશ્ન જ છે. દુનિયામાં ભુખ્યા રહેવાથી મરે છે એના કરતાં કેટલાંય વધુ લોકો વધુ પડતું ખાવાથી મરે છે પણ આપણને વધુ પડતું ખાવું છે. દોડવું છે. મેળવવું છે પણ સંતોષ? ના એનો કોઈ એંધાણ નથી. કોઈ સંતોષી અને સુખી દેખાતાં અલગારી માણસને જોઈને પુછી લેવાય છે કે ભાઈ તારી બધી જરૂરિયાતો પુરી થઈ ગઈ? જવાબ મળે છે કે રોજ હું મારી જરૂરિયાતોની યાદીને નાનીને નાની કરતો જાઉં છું. એટલે સુખી છું. પણ તરત આપણાં મનમાં એના માટે શબ્દો નીકળી પડે છે. “સાવ પંતુજી જ રહ્યો”

□ નિખિલ પરીખ (૩-૩-૯૭)

ગુણિયલ, નારાયણી નારીનો સ્ત્રી સુલભ તોફ તાવગુણ ઈર્ષા

સ્ત્રી એક નારી, નારાયણી, માતા, ભગીની, ભાર્યા, દીકરી, વહુ વગેરે વગેરે. તેના અનેક રૂપ. જન્મે ત્યારથી તેની ઓળખ પુત્રીની બને છે. બહેનની બને છે. જેમ જેમ તે મોટી થાય, જોબન છલકાય અને એ અરમાનોથી છવાઈ જાય છે. નવવધુના કોડ લઈ પારકી બને છે ત્યારે તે નવવધુ કહેવાય છે પરંતુ ત્યારે તેના માતા પિતાની અશ્રુભીની આંખે એક જ વાત કહે છે. દીકરો જન્મે ત્યારે તેને કુળ દીપકનું લાડલું બિરુદ મળે છે પણ સાસરે જતી દીકરીને માતાપિતા કહે છે તું બેઉ ઘરને અંજવાળતી દીવડી બનજે પરંતુ આ શીખને હૈયામાં ઉતારનાર દીકરીઓ બહુ ઓછી હોય છે. સ્ત્રી એક શક્તિ કહેવાય છે. સ્ત્રી લક્ષ્મી તરીકે પૂજાય છે. પરંતુ એક એવો અવગુણ એનો છે અને તે છે “ઈર્ષા” અને આ અવગુણથી સુંદર, નમણી, નાજુક નારીનું બીજુ પાસુ પલટાઈ જાય છે. સાસુ-વહુ, દેરાણી-જેઠાણી, નણંદ-ભોજાઈ, બહેન-બહેન આ પાત્ર જોડી અપવાદ રૂપ છોડી પોતાનો જ સંસાર ઈર્ષાની અગ્નિથી બાળે છે. ચિંગારી નાની હોય છે ત્યારે તેને ખબર નથી પડતી કે ક્યારેક એ મને પણ બાળી દેશે. અને એથીય ભયંકર વાત તો એ છે કે સ્ત્રી જ સ્ત્રીની દુશ્મન બને છે અને એ તો ખરેખર શરમજનક જ કહેવાય. એક રેસ દોડવાની હોય અને આપણે આગળ આવવું હોય એ માટે બીજા કઈ રીતે પાછળ રહે અને હું આગળ નીકળું અને આ સોચ જ ખરેખર બહુ હીણી લાગે છે. એક કહેવત સાંભળી હતી કે, “બે શોક્ય ના મગ ચડે પણ બે દેરાણી જેઠાણીના મગ ના ચડે” અને એ ઈર્ષા સૂચક સ્વભાવ બતાવે છે. બીજી એક કહેવત

હતી. “ આ પાણીએ મગ ના ચડે” એટલે ઘણી સ્ત્રી માતા નથી બની શક્તી ત્યારે સાસુનું બિરુદ ધરાવતી સ્ત્રી આ રીતે બોલે છે, અમે એમાં પણ ઈર્ષાની ચિંગારી હોય છે. એટલે કે બીજી બાયડી લાવે પરણીને દીકરો એમનો. આની વાત અહીંયા અને અહીંયાની વાત ત્યાં કરીને ઉપરથી ચટાકેદાર મીઠું, મરચું ભભરાવીને અને એ જે વ્યક્તિવિશેષ માટે ઉચ્ચરાયું હોય અને ત્યારે તેને ખબર પડે એટલે કડવાશના બીજ રોપાય છે. સ્ત્રી માટે કહેવાય છે એકથી બે મળે તો ગપસપ થાય. “ત્રણ મળે તો ત્રેખડ થાય” અને મળે જો “ચાર ચોટલા તો ભાંગે ઘરના ઓટલા” આમ કોઈની વાત કાંઈ ન હોય તેમાં જૂઠાણાનો મસાલો ભભરાવી ચાર જણીઓ કોકનું ઘર જરૂરથી ભાંગે છે. બે ઝગડે , ત્રીજો ખુશ થઈ તાળીઓ પાડે છે દૂર ઉભા રહીને અને સૌથી બુરી વાત તો એ કે પાછળ ચુગલી કરવાની, નિંદા કરવાની, અને વાત ન હોય તો પણ ઉપજાવી કાઢીને પણ ઝગડવાની, મારવાની. આ કળામાં પારંગત બહેનોનું પેટ ચડી જાય છે. જો આવી કોઈની કુથલી કરવા ન મળે તો, અને વળી વાત પલટાવીને ખોટા સાચાં કરવામાં તો સ્ત્રીઓ એક્સપર્ટ છે. ઘરના વરો જાય અને નવરાશની પળોમાં કાં તો ટેલીફોન અને નહી તો પડોશમાં જઈને અથવા તો કોઈ જાહેર જગ્યાએ જેમ કે મંડળોમાં, મંદિરોમાં, કીટી પાર્ટીઓમાં યા સત્સંગ મંડળોમાં, નથી સમજાતું કે સારી પળોએ સારી વાતો કરીએ, નવું નવું જાણીએ, વિચારીએ, મેગેઝીનો વાંચીએ, સેવાના કાર્યો કરીએ. આવી સારપ છોડી કોઈના પાપ ધોવા, કિચડ ઉછાળવો, નિંદાં કરવી, ઈર્ષા કરવી અને આ બધું સારા ઘરની વહુ દીકરીઓ યા તો સાસુઓ પાછળ નિંદા કરતી જ રહે છે.

“આ તો મારા વરની પાછળ જ પડી છે, જ્યાં

જાય ત્યાં તેને અથડાય, હાથ લગાડવાની કોશિષ કરે છે. બેન બેનમાં પણ અચૂક આવી ઉચ્ચારણા થતી સાંભળી છે. પણ ત્યારે ઈર્ષાની આંધીમાં અટવાયેલી બેનો, સ્ત્રીઓ ભૂલી જાય છે કે એક આંગળી આપણે સામાની સામે ઉઠાવીએ તો બીજી ચાર આંગળી આપણી જ સામે તાકેલી જ રહે છે. ઈર્ષાની આંધીમાં અંધ બનેલી બેનો વિચારજો કે આપણે જે થૂંક બીજા પર ઉડાડીએ છીએ તે આપણા પર જ ઉડે છે. પોતાનો સંસાર પોતે બાળે છે. આપણા બાળકો પર શું સંસ્કાર પડે, તેઓ સમાજમાં માથુ ઉંચુ કરીને કેમ કરીને ચાલી શકશે? વળી કંઈક સ્ત્રીઓ પરણેલા પુરુષોને પોતાની ચુંગલમાં ફસાવે છે. કોઈને ત્યકતા બનવું પડે, તો કોઈને છૂટાછેડા, તો વળી કોઈને આત્મહત્યા કરવી પડે છે. નાની હતી ત્યારે એક કિસ્સો એવો સાંભળ્યો હતો કે જેઠાણીએ દેરાણીને ગેલેરીમાં ઉભેલી જોઈ બોલી કે “જોને કેવી નાયકણ થઈને ઉભી છે રાડં થઈને, જરાયે શરમ છે?” કારણ તેનાથી થોડે જ દૂર તેના જેઠ ઉભા હતા અને આમ આ સારા ઘરની સુશિલ સુશિલા બળીને મરી ગઈ હતી. આવા તો ઘણા ઘણાં કિસ્સાઓ બને છે. એક બેન (જૈન) ડીલીવરી માટે પીયેર આવી તો તેનો પતિનો સાળીની જોડે સંબંધ થઈ ગયો અને તેનું તથા બાળકનું ભાવિ અંધકારમય બની ગયું? આવા અગણિત બનાવોથી સ્ત્રી અધ:પતનની ધોર ખાઈમાં ફેંકાઈ જાય છે. કારણ કર્મના ફળ અંતે તો ભોગવવા પણ પડે છે.

સભ્ય સમાજમાં પોતાનું એક આગવું સ્થાન, પર્સનાલિટીની ઈમેજ ઉભી કરો, તમારું તમારા બાળકોનું અને ઘરનાનું માન વધારો, તમારા ઘરના પુરુષો માથુ ઉંચુ કરી સમાજમાં ફરી શકે એવા સારા કોઈ કર્મ કરો, કુકર્મ જો ઘરવાળી કરતી રહે તો વરો શરમથી કોઈને મોટું પણ ન બતાવી શકતા હોય. કંઈક

સ્ત્રીઓની જીભે જુઠાણુ તો રમતુ જ હોય છે. મોટાઈ તો એવી બતાવે પણ એમની અંદરથી પોલંપોલ હોય. સ્ત્રી એક બેસ્ટ શિક્ષિકાની ગરજ સારી શકે છે. સ્ત્રીનું માતા રૂપ, બેન, ભગીની, ભાર્યા રૂપને દીપાવો.

તમારા જ ગામની વ્યક્તિ વિશેષ હોય તેનું માન કરવાને બદલે ઘર આંગણો વહેતી ગંગાને ન ઓળખે અને બહારના ખાબોચિયા તરફ નજર દોડાવે એ શું બતાવે છે સ્ત્રી સુલભ ઈર્ષા. કુવાના મેંડકને શી ખબર કે બહારની શી દુનિયા છે. આપણે ભદ્ર સમાજ, ભદ્ર સોસાયટીમાં તમે કંઈક કરી બતાવાની ભાવના રાખો. એક બીજાના ટાંટિયા ખેંચવા એ શું સૂચવે છે. એક વ્યક્તિ વિશેષ બેન દાન કરે તો તેને બીરદાવવાને બદલે કહેશે કે દાન કરીને શું કહી બતાવવાનું? નથી સમજતા કે દાન આપનાર બેન આપણા જ ગામને, આપણા જ સમાજની જરૂરીયાતવાળી વ્યક્તિઓને ઉપયોગી થાય છે અને એ જોઈ બીજાને પ્રેરણાદાયી બનવાની જાગૃતિ જાગે એટલે દાન કરેલું જાહેર થાય એમાં કશું જ ખોટું નથી હોતું. પરંતુ આમાં પણ ઈર્ષાનો ભાવ છૂપો પ્રગટ થાય છે. માનવ દેહ અને તેમાં સ્ત્રીઓ કંઈક સારું કરવાની ભાવાના રાખો. પોતાના દેશ વતન માટ એલાગણી કરી પ્રેરણાદાયી બનવાને બદલે ઈર્ષા સુલભ બધાં નાનું મોટું દાન કરતાં જ હોય છે. ડાબા હાથને પણ જાણ ન થવી જોઈએ. આમ સ્ત્રી સુલભ ઈર્ષાળુ સ્વભાવ છતો થાય છે. ઘરમાં, સમાજમાં, દેશમાં કોઈ વ્યક્તિ વિશેષ હોય તેનું માન કરો. તેની સેવાઓને તેમના કાર્યને બીરદાવો. આપણામાં હોય એના કરતાં એમની પાસે કંઈક વિશેષ છે અને એ વિશેષતાને બિરદાવી કંઈક મેળવો. સમાજમાં કુથલીખોર, ઈર્ષા, જૂઠાણુ તથા એકબીજાની પાછળ બોલી કોઈના ઘર ભંગાવવા આવા બધા દૂષણો નવરાશની પળોએ સુઝતા હોય છે અને

એટલે જ એ નવરાશની પળોને પાસે ન આવવા દેતાં કાર્યરત રહો. સારું વાંચન કરો. એક બીજાને કોઈને કોઈરૂપે મદદગાર બનો. ઉપર ઠાકોરજીને શો જવાબ આપશો? તમારા બાળકોને કયા સંસ્કારનો વારસો આપી જશો? સમાજને અને સમાજની બેનોને સુસંસ્કૃત બનાવી શકે એવો મહિલા મંડળનો પ્રયત્ન રહેવો જોઈએ. મહીલાઓ ભેગી થઈ મહીલા મંડળ ચાલવે, એ માટે પ્રક્ષક ગણા, સભ્યોની જરૂરત પડે અને ત્યારે તમે એમાં ખુરશી પર આરુઢ થઈ કંઈક કરી બતાવવાની ભાવના રાખો. સમાજની બેનોનું સંગઠન કરી તેમને બીરદાવો. તેમની શક્તિઓને ખીલવો, તેમની ટેલંટને બહાર આવવાનો મોકો આપો અને એનાથી એક કારકંડે બે પક્ષી મરે એવો ઘાટ ઘડાશે. બહારનાને પ્રોગામો માટે બોલાવવા ન પડે. પૈસાનો વ્યય ઓછો થાય અને આપણી સમાજની બેનોને આગળ આવવાનો, સમાજની બેનોને શીખવાનો - શીખાવવાનો મોકો આપો. ઘણી ઘણી બેનો પાસેથી ઘણી ઘણું જાણવા મળશે. એક બીજો દાખલો આપીશ આપણાં સમાજમાંના બેન સુરેખાબેન સત્સંગ કરાવે છે. તેમને તો નાની મોટી બધી બેનો ઓળખતા હોય છે. દરેક બેનો એમના પ્રવચનમાં સક્રિયપણે રસ લે છે અને માણે છે. અને એમનામાંથી કંઈક ગ્રહણ કરે છે. એ જ રીતે સમાજની બીજી વ્યક્તિ વિશેષ પાસેથી પણ ઘણું જ્ઞાન હોય તો તેમની પાસેથી કંઈક મેળવવાની તક ઝડપો અને સમાજને સુસંસ્કૃત બનાવો. નવરાશની પળોનો દૂર ઉપયોગ કરતી બેનો આમાં કાર્યરત રહેશે. સમાજનું સુદંર આયોજન આવી મહીલાઓ એકઠી થાય ત્યારે જ થાય તમારી અંદરની શક્તિને સારા કાર્યો કરીને ખીલવો. બહાર લાવો. ગામની ચોવટ છોડી દૂર નજર દોડાવો. દુનિયા ઘણી વિશાળ છે. તેમાંથી રસ, રંગ, રૂપ અને સ્વાદ મેળવો. તમારામાં રહેલી સારપને બહાર કાઢો. નિંદા, ઈર્ષા

જેવા શબ્દોનો અપભ્રંશ કરો સદગૃહીણી બનો. ઘરનાં સાસુ સસરાની સેવા કરો. જેમ આવકાશયાનમાં કલ્પના ચાવલા સન્માનને પાત્ર સાયન્ટીસ્ટ હતા. તેવી જ રીતે બીજી ઘણી ઘણી આર્દશ સન્મારીઓના વ્યક્તિ વિશેષ જીવનમાંથી ઘણી ઘણું મેળવવાની, પામવાની કોશિષ કરો. વાંચન વિશેષ રાખો. તમે કેવા છો? કેવા બનશો? સમાજને શું આપશો? બાળકોને કેવા સંસ્કારોનો વારસો આપી જશો? તમરી આગવી ઈમેજ ઉભી કરો. હસો, હસાવતાં રહો અને સમાજને ઘરનાંને ઉપયોગી બની સેવા કરતાં રહો. માનવ જીવન અને એમાંય વળી સ્ત્રીનો લક્ષ્મી અવતાર, નારાયણી અવતાર, શક્તિ અવતાર મળ્યો છે કે મળશે!! સોચ અપની, કેડી કંઈક પકડશો. સંસારને સાંકળતી કડી બનો. નહીં કે વીખેરતી ઈર્ષાળુ નારી.

□ ઉષા શૈલેષકુમાર ધારીયા

જીવન શું છે

જીવન યુદ્ધ છે	- તેનો સામનો કરો
જીવન શાળા છે	- તેનાથી શિક્ષણ મેળવો
જીવન ગીત છે	- તેનાથી પ્રેમથી ગીત ગાઓ
જીવન પાત્ર છે	- ને નિભાવો
જીવન રહસ્ય છે	- તેનું પ્રકટીકરણ કરો
જીવન તક છે	- તેનો પુરો લાભ લો
જીવન સ્વપ્ન છે	- તેનો સાકાર કરો
જીવન મુસાફરી છે	- તેને પૂર્ણ કરો

જીવનને સારી રીતે માણવા માટે આ બધી દુઃખદ સ્મૃતિઓને દિલ અને દિમાગમાંથી હાંકી કાઢી હળવા ફૂલ થઈ જવું જોઈએ. આમ કરવાથી તમારે માટે પ્રગતિનાં દ્વાર આપોઆપ ખૂલી જશે.

શ્રી ગોકુલેશો જંચતિ

કાંદિવલીમાં વસતા સૌ બાલાસિનોરવાસીઓ તરફથી આમંત્રણ પત્રિકા ૯ મું વર્ષ

ફગવા ઉત્સવ

શ્રી ઠાકોરજીની અસીમકૃપાથી કાંદીવલીમાં વસતા બાલાસિનોરવાસીઓ તરફથી શ્રી ફગવાઉત્સવનું આયોજન કરવામાં આવેલ છે. આ ફગવા ઉત્સવ સં. ૨૦૬૦ના મહાવદ-૧૦ ને રવિવાર, તા.૧૫.૨.૦૪ના રોજ સ્વીમીંગ પુલ, એમ.જી. કોસ રોડ નંબર-૨, કાંદીવલી (વેસ્ટ), મુંબઈ - ૬૭ના મુકામે યોજવામાં આવેલ છે. તો બાલાસિનોરના સર્વે વૈષ્ણવોને ઉપરોક્ત મુકામે સહકુટુંબ પ્રસાદ લેવા પધારવા અમારું ભાવભર્યું આમંત્રણ છે.

❀ ઉત્સવના મનોરથી ❀

શ્રી સુનીલ રજનીકાંત પરીખ (લેહંટા)

❀ શોભાયાત્રા ❀

મનોરથીના નિવાસસ્થાન એ/૧૨, શિવતીર્થ, શંકરગલી, કાંદીવલી (વેસ્ટ), મુંબઈ - ૪૦૦૦૬૭ સવારે ૮.૦૦ કલાકે સમાજ બેસશે. તેમજ કળશનો વરઘોડો તેમના નિવાસ સ્થાનેથી સવારના ૧૦.૩૦ કલાકે નીકળીને સ્વીમીંગ પુલ, એમ.જી.રોડ ખાતે આવશે.

❀ લી. ❀

શ્રી સુનીલ રજનીકાંત પરીખ (લેહંટા)
તેજશ સુનીલ પરીખ (લેહંટા)ના જે જે શ્રી ગોકુલેશ

❀ ખેલના દર્શન ❀

બપોરના ૧.૦૦ કલાકે સ્વીમીંગ પુલ ખાતે શ્રી ઠાકોરજીના ખેલના દર્શન થશે. તેમજ ૪.૦૦ કલાકે શ્રી ઠાકોરજીના ઘોળ-કીર્તનતેમજ રસિયા ગવાશે. તો દરેક વૈષ્ણવોને ઉપરના દરેક પ્રસંગે ઉપસ્થિત રહીને અલભ્ય આનંદ (લાભ) લેવા વિનંતી છે.

❀ લી. ❀

કાંદીવલીમાં વસતા બાલાસિનોરવાસીઓના

જે જે શ્રી ગોકુલેશ

વિદ્યાર્થીઓ માટે યોગરૂપી માર્ગદર્શન

વાંચન-લેખન વખતે શારીરિક તથા માનસિક પીડા અવરોધરૂપ બનતી હોય છે. તન અને મનની સ્વસ્થતા દ્વારા એકાગ્રતાપૂર્વક અભ્યાસ થઈ શકે છે.

જો તમને ટૂંકા અથવા લાંબા વખતથી કોઈ બિમારી સતાવતી હોય જેવી કે પેટની ગરબડ, શરદી-ખાંસી, માથાનો દુઃખાવો, ચક્કર આવવા, આંખોમાં થાક વર્તાવો, પીઠના દુઃખાવો, પગના દુઃખાવા, આતંરિક ભય લાગવો, બ્લડપ્રેશરમાં વધઘટ, ગભરામણ, ડીપ્રેશન, શરીરમાંથી સ્ફૂર્તિ અને તાજગીનો અભાવ, એસીડીટી કે અન્ય કંઈપણ..... યોગની સાવ સરળ અને સહેલી પદ્ધતિઓ દ્વારા તમારા બધા અવરોધો દૂર હટાવી દો.

પ્રાણાયામ, આસન યોગના મુખ્ય અંગ છે. મુદ્રાઓ પણ મદદરૂપ નિવડી શકે છે. સરળ પદ્ધતિઓ દ્વારા યાદશક્તિ કેમ વધારવી, વાંચેલું યાદ કેવી રીતે રાખવું, ભયમુક્ત કરી રીતે બની જવું, વાંચવામાં એકાગ્રતા કેવી રીતે કેળવવી, શરીરને કઈ રીતે રીલેક્સ કરી દેવું, સેલ્ફ સજેશન્સ માટે શું કરવું?

આવી અગત્યની બાબતો દ્વારા ઓછા સમયમાં વધારે સિધ્ધિ હાંસલ કરી શકાય છે.

ઘણીવાર ઘરનું અથવા બહારનું વાતાવરણ યોગ્ય હોતું નથી. ઘણીવાર ઘરની વ્યક્તિઓનો સહકાર ઓછો અથવા અપૂર્ણ હોય છે. આવી બધીજ બાબત અભ્યાસ પર અસર કરતી હોય છે.

આપની ઈચ્છા હોય તો આપ અવશ્ય નિસંકોચ સંપર્ક કરો. સંપૂર્ણ માર્ગદર્શન નિઃશુલ્ક આપવાની પ્રેરણા મારા ગુરુજનો પાસેથી મળી છે. યોગ વિદ્યાનો લાભ અભ્યાસ માટે જરૂર લો અને ખૂબ જ સારા માર્ક્સ મેળવી સફળતા અને યશ પ્રાપ્તિ કરો.

આટલું અવશ્ય કરો

૧. માતા-પિતાનો આદર કરો
૨. ગુરુજનો પ્રત્યે વિનમ્રતાપૂર્વક વર્તન કરો
૩. કુદરતની શક્તિમાં વિશ્વાસ રાખો
૪. કુદરતને પ્રેમ કરતાં શીખો. વૃક્ષો, સૂરજ, આકાશ, ચંદ્ર, તારા મંડળ, સાગર, નદી, ઝરણાં, પશુ, પક્ષીઓનો કલરવ. આ બધા તરફ સમયે સમયે દૃષ્ટિ કરો, આનંદ મેળવો, આનંદમાં લીન થાવ.
૫. સમયસર પદ્ધતિસર જમાવાનું રાખો
- ૬ વધુ પડતો ઘોંઘાટ, પોલ્યુશનવાળા વાતાવરણમાં ફરવાનું ટાળો
૭. પોતાની જાત પર સંપૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ રાખો

(કમશ)

□ બંકિમ પરીખ

શ્રીજીને

સુખમાં શ્રીજીને ભજીલે, દુઃખમાં કામ આવશે રે
સુખનો સાચો ભેરૂએ, દુઃખમાં હામ ભીડશે રે
સુખ દુઃખ જીવન ધારાએ, બેઉ સંગાથે ચાલે રે
સુખથી ભરમાય શાને?, દુઃખથી શાનો ભાગે રે
મણ મણ પૈસો તારો એ, શું કામ અંતે આવે રે
કણ કમ રામ તારો એ, દોડી સામે આવશે રે
સુખના સાથી તારા એ, દુઃખમાં સાથ છોડે રે
ભજી લે, તું ભજીલે શ્રીજીને, શેષ બાકી રહેશે રે!

- “ચાંદશા”

□ ચંદ્રકાંત શાહ (ચટઈ)

શ્રી બાલાસિનોર નવયુવક સંઘ સંચાલિત

શ્રી નટવરલાલ મોદી (જનસાથી) પુસ્કૃત

જનસાથી ટ્રોફી લોકલ ટુર્નામેન્ટ

૩૬ વર્ષોનો ઈતિહાસ સર્જતી શ્રી નીતીન પરીખ (બખલી) ની ટીમ એક અહેવાલ....

બે ગ્રુપોમાં વહેંચી (૧) શ્રી રાજેષ આર. મહેતા (૨) શ્રી ઉમેશ કે. દેસાઈ

મેચ - ૧

કીજલ પરીખ ની ટીમ - ૧૭૫ રન ઓલઆઉટ,

કુનાલ ધારીઆ-૩૦ રન, બીપીન ગાંધી-૩૫ રન, સચીત પરીખ-૨૫ રન, નીમીષ પરીખ-૨૦/૪ વિકેટ, સમીર સી. દેસાઈ-૫૪/૪ વિકેટ, સતીષ લાકડાવાળા-૪૪/૨ વિકેટ નીરેન ધારીઆની ટીમ - ૧૭૬ રન ૪ વિકેટ નીરેન ધારીઆ-૭૭ રન, સમીર સી. દેસાઈ ૨૮ રન, રીતેષ કડકીઆ (નોટ આઉટ) - ૩૭ રન, અર્પૂવ ધારીઆ-૨૨/૨ વિકેટ

-: નીરેન ધારીઆની ટીમનો વિજય :-

મેચ -૨

ચીરાગ જે. દેસાઈની ટીમ - ૨૪૫ રન ઓલ આઉટ,

ધરવ પરીખ-૩૪ રન, મીતેષ ધારીઆ-૩૦ રન, નીરવ કડકીઆ- ૨૬ રન, સમીર મોદી-૪૦ રન, શ્રમીક શાહ - ૪૧/૪ વિકેટ, રાહીલ ધારીઆ - ૫૧/૨ વિકેટ, સંજય મોદી તથા સંકેત મોદી - ૨ વિકેટ, સુકેતુ પરીખની ટીમ- ૧૦૮ રન ઓલ આઉટ, સુકેતુ પરીખ-૨૧ રન, શૈષવ શાહ-૧૭ રન, ધરવ પરીખ-૧૩/૩ વિકેટ, નીતીન ગાંધી-૪/૨ વિકેટ.

-:ચીરાગ જે. દેસાઈની ટીમ વિજેતા:-

મેચ -૩

નીરવ દેસાઈ V/S આનંદ શ્રોફ

આનંદ શ્રોફની ટીમ - ૨૨૨ રન ઓલ આઉટ, અંકીત પરીખ-૫૫ રન, તુષાર પરીખ-૩૧ રન, અમીત કડકીઆ- ૨૧ રન, નીલેશ કડકીઆ-૨૦/૩ વિકેટ, નીરવ દેસાઈ-૩૪/૫ વિકેટ, ચીરાગ મોદી-૨૭/૨ વિકેટ, નીરવ દેસાઈની ટીમ - ૨૨૪ રન ૩૮.૪ ઓવર્સ, પિયુસ પરીખ - ૩૨ રન, નીરવ દેસાઈ-૨૮ રન, અમીષ દેસાઈ-૨૪ રન, રૂપેશ મોદી-૩૫/૪ વિકેટ, જીગર પરીખ-૨૪/૨ વિકેટ

-:નીરવ દેસાઈની ટીમ વિજેતા:-

મેચ-૪

નીતન જે. પરીખ V/S રવિશ દેસાઈ

નીતીન પરીખની ટીમ - ૧૩૫ રન ઓલઆઉટ, સંદીપ ધારીઆ-૩૫ રન, અનીષ દોશી - ૨૩ રન નોટ આઉટ, વિનીત મોદી-૪/૫ વિકેટ, સૌમીલ કડકીઆ -૩૮/૪ વિકેટ, રવિશ દેસાઈની ટીમ - ૨૬ રન ઓલ આઉટ, સંદીપ ધારીઆ-૮/૮ વિકેટ, સાહીલ દેસાઈ-૧૬/૩ વિકેટ

-:નીતીન પરીખની ટીમનો વિજય :-

(૩૬ વર્ષોનો સૌથી ઓછો સ્કોર કરતી ટીમ)

મેચ -૫

નીતીન જે પરીખ V/s સુકેતુ પરીખ

નીતીન પરીખની ટીમ - ૨૭૬ ઓલ આઉટ, સાહીલ દેસાઈ-૯૬ રન, અનીષ દોશી-૪૧ રન, પરેશ પરીખ-૪૫ રન, મીહીર કડકીઆ-૨૨ રન, શ્રમીક શાહ -૪૫/૬ વિકેટ, રાહીલ કડકીઆ-૪૫/૩ વિકેટ, સંજય મોદી-૬૦/૩ વિકેટ, સુકેતુ પરીખની ટીમ - ૧૧૯ રન ઓલ આઉટ, ગોપાલ શેઠ-૨૨ રન. રાકેશ ધારીઆ (બકી)-૨૨ રન, સંદીપ ધારીઆ-૦૨૧/૪ વિકેટ, સાહીલ દેસાઈ-૩૬/૩ વિકેટ, રૂપીન કડકીઆ-૨૪/૩ વિકેટ, અનીષ દોશી-૧૭/૨ વિકેટ.

:- નીતીન પરીખની ટીમનો વિજય :-

મેચ -૬

રવિશ દેસાઈ V/s ચીરાગ દેસાઈ

રવિશ દેસાઈ - ૯૪ રન ઓલ આઉટ, પ્રફુલ્લ ધારીઆ -૫૮ રન, સમીર આર. દેસાઈ-૧૮/૫ વિકેટ, રૂચીત દોશી-૧૦/૨ વિકેટ, બીનોયો પરીખ-૭/૨ વિકેટ, ચીરાગ દેસાઈ-૯૭ રન, ૧૫.૧ ઓવર્સમાં ૫ વિકેટ, ચીરાગ દેસાઈ - ૨૨ નોટ આઉટ, સમીર ધારીઆ - ૨૮ નોટ આઉટ, પંકજ કડકીઆ-૧૫/૨ વિકેટ, વીનીત મોદી-૧૭/૨ વિકેટ

:- ચીરાગ દેસાઈની ટીમનો વિજય :-

□ રાજુ એમ. પરીખ- કન્વીનર

મા મુજને તુજ યાદ સતાવે

યાદોના ઝરોખાંમાંથી, અતતીને નિહાળું,
તુજ સાથેની મીઠી પળને, પ્રેમથી વાગોળું,
મા મુજને તુજ યાદ સતાવે
બચપન માણ્યું તુ જ સંગાથે, પ્યાર ભર્યા ખોળામાં,
તુજ હૂંફ તણાં સથવારે, ને મમતાની છાયામાં,
મા મુજને તુજ યાદ સતાવે.
કપડાં ઘોવા તળાવ જાતી, પાણી ભરવા કુવે,
તારી સાથે રહીને શીખતી, ઘરનાં કામો સર્વ
મા મુજને તુજ યાદ સતાવે.
કળી ખીલીને ફૂલ ઉગ્યું, તુજ સ્નેહની ભીનાશે,
ઉપવન આખુ મહેંકી ઉઠ્યું, તુજ સંસ્કારી સુવાસે.
મા મુજને તુજ યાદ સતાવે.
લાગણી ભીનાં શબ્દો તારા, વાત્સલ્ય પ્રગટાવે,

મુશ્કેલીમાં રાહ બતાવી, મંઝિલે પહોંચાવે,
મા મુજને તુજ યાદ સતાવે.
હૃદય મારું દ્વવી ઉઠે, ને વદન કંપી ઉઠે,
તુજ વિદાયે, વ્યથિત થઈને દિલ રડી ઉઠે,
મા મુજને તુજ યાદ સતાવે.
દિવસો વીત્યા, વરસો વીત્યા, દાયકાઓ પણ વીતશે
સ્મૃતિ પટ પરની તારી ઝાંખી ક્યારે પણ ના મીટશે,
મા મુજને તુજ યાદ સતાવે.
મારા મન મંદિરમાં તો મેં તારી મૂરત રાખી
આંખ મીચીને સ્મરણ કરું તો આશીષ દેતી દેખી
મા મુજને તુજ યાદ સતાવે.
હાથ જોડીને, વંદન કરીને, પ્રાર્થી રહુ પ્રભુને
ધન્ય થાવું જો જનમ-જનમ , મુંજ મા બનાવે તુજને
મા મુજને તુજ યાદ સતાવે.

□ અમીતા ધારીયા

શ્રી વાડાસિનોર દશાનીમા નવયુવક મંડળ તથા મેડીકલ ટ્રસ્ટ

૭૫ વર્ષ તથા ૨૫ વર્ષ ઉજવણી પ્રસંગે પ્રાપ્ત થેયલા દાન માટેના વચનોની યાદી
ઓક્ટોબર - ૨૦૦૩ ના જ્યોતિપૂજમાં આપેલી વિગતો પછી મળેલી યાદી :-

- A.) રૂ.૨,૫૦,૦૦૦.૦૦ રૂ. બે લાખ પચાસ હજાર પુરા
૧) શ્રી કાંતાબેન લાલચંદ દોશી
૨) શ્રી મધુકાન્તા જંચતિલાલ પુરસોત્તમદાસ દેસાઈ
- B.) રૂ.૧,૧૧,૧૧૧ રૂ. એક લાખ અચ્ચાર હજાર એકસો અચ્ચાર
૧) શ્રીમતી લીલાબહેન ગુણવંતલાલ શાહ (સુરતવાળા)
- C.) રૂ.૫૧,૦૦૦.૦૦ રૂ. એકાવન હજાર પુરા
૧) શ્રીમતી સુધાબહેન પ્રવીણચંદ્ર કોદરલાલ શાહ (પી.કે.)
૨) શ્રીમતી સૂર્યાબહેન નવનીતલાલ ધારીઆ (માટલી)
- D.) રૂ.૨૫,૦૦૦ રૂ. પચીસ હજાર પુરા
૧) શ્રી નીતીન નટવરલાલ દેસાઈ (નાગર)
- E.) રૂ.૧૧,૦૦૦.૦૦ અચ્ચાર હજાર પુરા
૧) પરીખ એન્ડ બધર્સ
(શ્રી પ્રવીણચંદ્ર લલ્લુભાઈ પરીખ-રોકડીઆ)
૨) શ્રી રસીકલાલ ચંદુલાલ પરીખ (તાતીયા)
૩) શ્રી મણીકાંત છોટાલાલ કડકીઆ (બાલાસિનોર)
૪) સ્વ. મણીબેન લલ્લુભાઈ શાહ (ઝાટ) /
સ્વ. પ્રવીણચંદ્ર લલ્લુભાઈ શાહ
(હસ્તે : કાંતીભાઈ બલબલ)
રૂ.૪,૫૫૫.૦૦ ચાર હજાર પાંચસો પચાવન પુરા - વધારાનું ભંડોળ કુસુમબેન રસીકલાલ અને રસીકલાલ મ. લાકડાવાળા (પ).ચે ટ્રસ્ટ
શ્રી જતીન ન. દેસાઈ
શ્રી યોગેશ આર. ધારીઆ
માનદ્ મંત્રીઓ

શ્રી વાડાસિનોર દશાનીમા વિદ્યોતેજક મંડળ

સહર્ષ જણાવવાનું કે ૭૯મી વાર્ષિક સામાન્ય સભા નિમિત્તે રજૂ કરાયેલ વાર્ષિક અહેવાલ (મંત્રી નિવેદન)ના અનુસંધાનમાં ચાલુ માસમાં નીચે મુજબ પ્રસંશનીય દાન તેમજ શૈક્ષણિક સહાયની પ્રવૃત્તિ માટે આર્થિક સહાય પ્રાપ્ત થયેલ છે.

દાન : મંડળની આર્થિક સહાય લઈ ભણી ચૂકેલા વિદ્યાર્થી તપન દિપક શાંતિલાલ શાહ (પડાલવાળા) તરફથી રૂ. ૫૧,૦૦૦/- દાન રૂપે મંડળને પ્રાપ્ત થયા છે.

શૈક્ષણિક સહાય : શ્રી વંસત શાંતિલાલ પરીખ (કુવાવાળા) તરફથી શાંતિલાલ ચંદુલાલ પરીખ (કુવાવાળા) ચેરિટેબલ ટ્રસ્ટના ભંડોળમાંથી રૂ. ૨૯,૦૦૦/- મંડળ પાસે આવેલ શૈક્ષણિક સહાયની અરજીઓ પેટે ફાળવવામાં આવ્યા છે.

મંડળના સર્વે કાર્યકર્તાઓ તેમજ ટ્રસ્ટીઓ ઉપયુક્ત દાન તેમજ શૈક્ષણિક સહાય માટે સખાવતી દાતાઓનો આભાર માને છે

અસીત રમેશચંદ્ર દેસાઈ
કિરીટ રમણલાલ કડકીઆ (મલમ)
માનદ્ મંત્રીઓ

અમને જણાવતા અત્યંત આનંદ થાય છે કે શ્રી બાબુલાલ ચંદુલાલ શાહ (પડાલવાળા) તરફથી રૂ. ૧,૨૫,૦૦૦/- (અંકે રૂપિયા એક લાખ પચ્ચીસ હજાર પૂરા)નું ન્યાસકંડ ચાલુ માસ દરમ્યાન મંડળને પ્રાપ્ત થયેલ છે.

મંડળના કાર્યકર્તાઓ તેમજ ટ્રસ્ટીઓ સખાવતી દાતાનો હાર્દિક આભાર માને છે.

લિ. અસીત રમેશચંદ્ર દેસાઈ
કિરીટ રમણલાલ કડકીઆ (મલમ)
માનદ્ મંત્રીઓ

Father & Sons

A son is a warm spot in your heart and a smile on your lips.

In the beginning he is charmingly innocent, putting his Complete trust in you.

He comes to you for a hand to hold, and for the security only your arms can provide

He shares his tales of adventure, and knows how proud you are of his discoveries and accomplishments.

All his problems can be solved by a and a kiss from you and the and you share is so strong it is almost tangible....

Time passes and your innocent little boy starts to test his limits. He lets go of your hand to race into the midst of life without thinking ahead or looking both ways.

His problems have grown along with him, and he has learnt that you can't always make his life better or kiss his troubles away.

He spends much of his time away from you and though you long for the closeness you. Once shared, he chooses independence and privacy.

Discoveries and accomplishments aren't so easy to come by now, and sometimes he wonders about his worth.

But you know the worth of that young man. He is your past and your future. He is hopes and dreams that have

made it through each and every disappointment and failure.

In your heart, your son is precious and treasured. Together, you struggle through the years trying to find the right amount of independence for each new stage of his life, until finally, you had to learn to let him go.

Now you put your trust in him, leaving that son, whom you hold so dear, totally in his own care. You hope he always remembers that you have a hand for him to hold and arms to provide comfort or support.

Most of all, you hope that he believes in himself as much as you believe in him, and that he knows how much you love him.

એક અપીલ

♠ વેરાસાની સ્કુલમાં બાળકો માટે લાયબ્રેરી બનાવવામાં આવી છે. જેના માટે બે કબાટ કાચવાળા શો કેસ જેવા તથા ટેબલ ખુશીઓની જરૂરત છે. તો દાતાઓને શ્રી નવનીતભાઈ ઝાટનો સંપર્ક કરવા વિનંતી.

♠ સ્વ. શ્રી ચંપાબેન મોદી દ્વારા સ્થાપિત કસ્તુરબા ટ્રસ્ટ દ્વારા બાલાસિનોરની આસપાસના ગોમોમાં સ્કુલો માટે બેન્ચો આપવાનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે.

દાતાઓ સંપર્ક કરે :-

- ૧) કોકીલાબેન રમેશચંદ્ર ધારીઆ - ૨૩૬૨૩૩૨૭
- ૨) જયંતીભાઈ લલ્લુભાઈ ધારીઆ - ૨૩૬૮૦૩૧૮



શ્રી બા.ન. સંઘ સંચાલિત શ્રીમતી શાંતાબેન કાંતિલાલ દોશી પુરસ્કૃત મહિલા વિભાગ

બાલાસિનોર મહિલા મંડળ આયોજીત પ્રોગ્રામ સ્નેહ-સંમેલન ૧૫મી નવેમ્બરે રાખવામાં આવ્યો હતો. જેમાં બધા કરતાં કંઈક જુદું જ કરવાની ઈચ્છા હોવા છતાં વધુ મતે-તેમજ અમુક કારણોસર ચીલાચાલુ જ થઈ ગયો. નાટક “પડકાર” રાખવામાં આવ્યો હતો. સાથે નાસ્તો તેમજ ગીફ્ટ રાખવામાં આવી હતી. સંજોગોવશ નાસ્તાના અમુક પેકેટસ સમયથી થોડા મોડા આવવાના કારણે થોડી તકલીફ પડી છે. તે બદલ અમે દિલગીર છીએ. તમારા બધાનો સાથ અને સહકાર થી ૫૩૦ જણાની હાજરી હતી અને સાથે દસેક લકી પ્રાઈસીઝ રાખવામાં આવ્યા હતા. શરૂઆતમાં જ મુખ્ય મહેમાનોનું સન્માન કરી તરત જ નાટક શરૂ કરવામાં આવ્યું હતું.

આગામી કાર્યક્રમ : એક દિવસની પિકનીક

“શાંતિ સાગર રિસોર્ટ”

તા.૯ જાન્યુઆરી શુક્રવાર

સમય : સવારે ૬.૦૦ વગેરે

સ્થળ : ગોવાલ્યાટૅક બસ સ્ટોપ પાસેથી બસ ઉપડશે.

પરાવાળી બહેનોને માટે

સ્થળ : દાદર (વેસ્ટ), કબુતર ખાના પાસે, એન્ટોનિયા

ડિસિલ્વા સ્કુલ (Main Gate)

સમય : ૬.૧૫ વાગે આવી જવું

રૂપિયા ૨૨૦/- જેમાં આવા જવાનું ભાડું તેમજ સવારે નાસ્તો, બપોરનું જમણ તેમજ રાતના જમવાના પેકેટસ રેડી મળશે. સાથે વોટર રાઈડસમાં ફી એન્ટ્રી તથા પોપકોન, બરફના ગોળા તેમજ કેન્ડી

ફલોસની મજ માણવા જરૂરથી આવશો.

તો બહેનો કોઈપણ કમીટી બહેનોને નામ લખાવી દેશો અથવા ૨ જી જાન્યુઆરીએ ૩ થી ૫ માં સંસ્થાની ઓફિસે નામ લખાવી દેશો. થોડું વહેલું છે પણ જરૂરથી સમયસર આવી જજો. પાણીમાં હીંચકાની રાઈડ માટે ટાઈટસ ટી શર્ટ અથવા પંજાબી સુટ લાવવાનું ભુલશો નહિ.

□ સંયોજક - રત્ના કડકીયા

--: મેડીકલ કેમ્પ :-

શ્રી વાડાસિનોર દશાનિમા નવયુવક મંડળ મેડીકલ ટ્રસ્ટ તથા શ્રી બાલાસિનોર નવયુવક સંઘ (ઉપનગર વિભાગ) સહર્ષ યોજે છે. “મેડીકલ કેમ્પ” પરાવાસીઓના લાભાર્થે બોરીવલીમાં પ્રથમ વખત આયોજન કરવામાં આવ્યો છે.

જેમાં નીચે મુજબનું ચેક અપ કરવામાં આવશે

- ૧) એનીમીયા (કમ્પલીટ બલ્ડ કાઉન્ટ - C.B.C.
- ૨) ઓસ્ટીયો પોરોસીસ (બોન ડેન્સિટી ચેક અપ)
- ૩) જનરલ મેડીકલ ચેક અપ

સ્થળ : ડૉ. રજત પુનમચંદ મોદી - આશિષ નર્સિંગ હોમ, સોડાવાલા લેન, બોરીવલી (વેસ્ટ), મુંબઈ - ૯૨

તારીખ : ૧.૨.૨૦૦૪ને રવિવાર * સમય : સવારે ૯ થી ૧ કલાક

જેમાં પરા વિભાગના નિષ્ણાત ડૉક્ટરોના સાથ સહકારથી રોગોનું નિદાન કરી યોગ્ય માર્ગદર્શન અપાશે. એનીમીયા તથા ઓસ્ટોપોરોસીસના ચેક અપ પછી જરૂરીયાતવાળાઓને ત્રણ મહિના સુધી ફી દવા આપવામાં આવશે.

આ કેમ્પમાં ભાગ લેવા ઈચ્છતી દરેક વ્યક્તિએ રૂ. ૨૦/- આપી નામ રજીસ્ટર કરાવવું પડશે. વહેલો તે પહેલો ધોરણે ફક્ત ૧૫૦ વ્યક્તિના નામ તા.૨૨.૧.૨૦૦૪ સુધી રજીસ્ટર કરવામાં આવશે.

C.B.C. માટે તા. ૨૨.૧.૨૦૦૪ થી રાજેશ આર. શાહને કાંદિવલી મળવું
બાયોકેમ કલીનીક લેબોરેટરી, ૬, ત્રીભુવન ટેરેસ, સ્ટેશન રોડ, (રેલ્વે ફાટક રોડ), કાંદિવલી (વેસ્ટ), મુંબઈ-૬૭

સમય : સોમ થી શનિ સવારે ૯ થી સાંજે ૬ * રવિવાર સવારે ૯ થી બપોરે ૧૨ સુધી

ફોન : ૨૮૦૭૨૭૪૫

નામ નોંધાવવાના સ્થળ :

- ૧) મેડીકલ સેન્ટર : ૮/૮, મહેતા હાઉસ, ભારતીય વિદ્યા ભવન સામે, મુંબઈ - ૪૦૦ ૦૦૭
- ૨) શ્રી બાલાસિનોર નવયુવક સંઘ : ૧૧૮/૧૨૦, અરદેશ દાદી સ્ટ્રીટ, વી.પી.રોડ, મુંબઈ - ૦૪
- ૩) હેમેન્દ્ર આર. શાહ -સંયોજક : સી/૩૦૨, સુમેર નગર, એસ.વી. રોડ, બોરીવલી (વેસ્ટ), મુંબઈ - ૪૦૦ ૦૯૨

આ ઉપરાંત કાંદિવલી - ગોપાલ કડકીયા, મલાડ : દિલિપ ધારિયા (સહમંત્રી)

અંધેરી : કલ્પેશ ધારીઆ, પાર્લા : સુરેશ પરીખ

શ્રી બાલાસિનોર નવયુવક સંઘ

મંત્રી - પ્રદિપ કડકિયા

સંયોજક - હેમેન્દ્ર શાહ

શ્રી વાડાસિનોર દશાનિમા નવયુવક સંઘ મેડીકલ ટ્રસ્ટ

મંત્રી - જતીન દેસાઈ - યોગેશ ધારીઆ

સંયોજક - મોહન પરીખ

આંતરિક સ્મત ગમત વિજેતા હરીફોના

નામ વર્ષ, ૨૦૦૩

કેરમ સીંગલ્સ (જૂનીયર)

- ૧) ધ્રુવેશ કિરણ મોદી
- ૨) શ્રેનીક શ્રેયસ શાહ
- ૩) શૈષવ ઉદય શાહ

કેરમ સીંગલ્સ (સીનીયર)

- ૧) ભાવીક રાજુભાઈ ધારીયા
- ૨) સુનીલ બાબુલાલ પરીખ
- ૩) રાજેશ કીર્તનલાલ ધારીયા

કેરમ ડબલ્સ (જૂનીયર)

- ૧) ધ્રુવેશ કિરણ મોદી - હાર્દીક બીપીન મોદી
- ૨) નીકીશ શીરીષ પરીખ - અમન મનોજ કડકીયા
- ૩) શોહમ પરેશ મોદી - રોમીલ ધર્મશ પરીખ

કેરમ ડબલ્સ (સીનીયર)

- ૧) અજીત નટવરલાલ મોદી - જીનેશ કાંતીલાલ કડકીયા
- ૨) શશીકાંત નટવરલાલ મોદી - રાજેશ કચેરીયા
- ૩) સુનીલ બાબુલાલ પરીખ - શૌમીલ જીતેન્દ્ર મોદી

કેરમ સીંગલ્સ (મહિલા)

- ૧) શૈફાલી મનીષ કડકીઆ
- ૨) જીગ્ના કલ્પેશ મોદી
- ૩) પ્રતીક્ષા ગાંધી

કેરમ મીક્ષ-ડબલ્સ

- ૧) દેવાંગ વ્યોમેશ પરીખ - દીષા ઉદય શાહ
- ૨) જીનેષ કાંતીલાલ કડકીયા - શૈફાલી મનીષ કડકીયા
- ૩) મનોજ કાંતીલાલ કડકીઆ - રોમા મનોજ કડકીયા

કેરમ સુપરહિટ મુકાબલા

- ૧) ઉદય શાંતિલાલ શાહ - શૈષવ ઉદય શાહ
- ૨) મનોજ કાંતીલાલ કડકીયા - કીંજલ મનોજ કડકીયા
- ૩) શ્રેયશ રસીકલાલ શાહ - શ્રેનીક શ્રેયસ શાહ

ટેબલ ટેનીસ

- ૧) કેતન રજનીકાંત ગાંધી
- ૨) પરાગ નટવરલાલ કડકીયા
- ૩) પ્રજલ નીલેશ પરીખ

બેડમિન્ટન

- ૧) સમીર રમેશચંદ્ર દેસાઈ
- ૨) ચીરાગ નીખીલ કચેરીઆ
- ૩) દક્ષેશ સોમાલાલ પરીખ

ચેસ

- ૧) ભાવીન કીરણ પરીખ
- ૨) રીતીક નીતીન પરીખ
- ૩) નીજેષ ચેતન કડકીયા

ઈનામ વિતરણ બાદ્ય સ્મતગમતના દીવસે ૧૮-૧૦-૨૦૦૪ના રોજ કરવામાં આવશે.

□ અજીત મોદી સંયોજક

શ્રી બાલાસિનોર ક્ષેત્રવર્ણી મંડળ - સુધારો -

નવેમ્બરનાં અંકમાં કાર્યવાહક સમિતિ ૨૦૦૩-૦૪માં ૨૦મું નામ શ્રી મણીકાંત ઓચ્છવલાલ શાહ છપાઈ ગયું છે તે સુધારીને શ્રી મણીકાંત છોટાલાલ કડકીઆ વાંચવું

તથા બાલપુષ્ટિ આહાર યોજનામાં એક નામ છપાયું નથી તે નીચે મુજબ વાંચવું

રૂા. ૧૧,૦૦૦.૦૦ અગ્યાર હજાર પુર જેસીકા પ્રવીણચંદ્ર કોદરલાલ શાહ (પી.કે.) સ્વ. દેવાંગી કુંતલભાઈ રાવલના સ્મરણાર્થે મળેલ છે. દાતાનો આભાર.

□ પ્રવીણ દેસાઈ, જતીન દેસાઈ - માનદ્ મંત્રીઓ

શ્રી બાલાસિનોર નવયુવકસંઘ સહર્ષ યોજે છે ૩૫મો બાહ્ય રમતગમતોત્સવ

આ વર્ષે ૩૬માં રમતગમતોત્સવનું આયોજન નીચે મુજબ કરવામા આવ્યું છે.

તારીખ : ૧૮-૧-૨૦૦૪

સમય : સવારે ૭-૩૦ કલાકે

નોંધ :

(૧) ગ્રુપ ૧ થી ૮ ની રમતોની હીટસ લેવામાં આવશે. હરીફોએ ગ્રાઉન્ડ પર સવારે ૭-૩૦ કલાકે હાજર રહેવું.

(૨) ગ્રુપ ૯ થી ૧૩ ની રમતોની હીટસ લેવામાં આવશે નહીં. ભાગ લેનાર હરીફોએ ગ્રાઉન્ડ પર ૧૧-૦૦ કલાકે હાજર રહેવું.

સ્થળ : યુનીવર્સિટી મરીન લાઈન્સ ગ્રાઉન્ડ, મુંબઈ-૨૦

-: ફોર્મ મેળવવાના સ્થળો :-

(૧) શ્રી બાલાસિનોર નવયુવક સંઘની આફિસ : ૧૧૮/૧૨૦, અરદેશરદાદી સ્ટ્રીટ, ચંદારામજી ગર્લ્સ સ્કૂલની સામે, સી. પી. ટેન્ક, મુંબઈ-૪૦૦ ૦૦૪.

(૨) મે. ઈમ્પેક્ષ એજન્સી એન્ડ ઈકવી. કું. : ૧૦૧/૧૦૩, નાગદેવી સ્ટ્રીટ, મુંબઈ-૪૦૦ ૦૦૩.

(૩) ચંદ્રેશ અન્ટરપ્રાઈઝ : શોપ ૧૭, દેવકરણ મેન્શન, પાઠકવાડી, લુહારચાલ, મુંબઈ-૨.

(૪) મે. પરીખ પેપર માર્ટ : ૮૮-ઈ, ખાડીલકર રોડ, (નારાયણવાડી), મુંબઈ-૪

-: ફોર્મ સંપૂર્ણ વિગતો સાથે ભરીને

પાછી આપવા માટેનું સ્થળ અને સમય:-

બાલાસિનોર નવયુવક સંઘની ઓફિસમાંથી

સોમવારથી શનિવાર (રાત્રે ૭-૦૦ થી ૮-૩૦ સુધી) તથા રવિવાર સવારે ૯-૩૦ થી ૧૧-૦૦ સુધી સ્વીકારવામાં આવશે.

ફોર્મ સ્વીકારવાની આખરી તારીખ ૧૧-૧-૨૦૦૪ રવિવાર રાખવામાં આવી છે. પરા વીભાગના હરીફો પોતાના ફોર્મ તેઓના સ્થાનિક સંચાલકોને સંપૂર્ણ વિગતો ભરી ૧૦/- રૂપિયા ફી સાથે મોડામાં મોડા તા. ૧૧-૧-૨૦૦૪ રવિવાર સુધીમાં આપી દેવા.

પ્રત્યેક ગ્રુપ દીઠ એક ફોર્મ ભરવાનું રહેશે. પ્રવેશ ફી ગ્રુપ દીઠ રૂ. ૧૦/- લેવામાં આવશે. ફોર્મની નીચેની સ્લીપ બતાવીને રમતગમતના દિવસે રૂ. ૧૦/- પાછા આપવામાં આવશે. હરીફો અંગ્રેજીમાં પણ ફોર્મભરી શકશે. ફોર્મ ઉપર વસ્તીપત્રક ક્રમાંક નંબર લખવો જરૂરી છે.

-: વિવિધ રમતો તથા તે માટેના ગ્રુપો:-

ગ્રુપ-૧	બાળકો ઉંમર વર્ષ ૪ થી ૬
જન્મ તારીખ	૧-૧-૯૮ થી ૩૧-૧૨-૨૦૦૦
રમત (૧)	૫૦ મીટર
રમત (૨)	કુગ્ગો લઈ દોડવાની રમત (૫૦ + ૫૦ મીટર દોડ)
ગ્રુપ-૨	બાલિકાઓ ઉંમર વર્ષ ૪ થી ૬
જન્મ તારીખ	૧-૧-૯૮ થી ૩૧-૧૨-૨૦૦૦
રમત (૧)	૫૦ મીટર
રમત (૨)	કુગ્ગો લઈ દોડવાની રમત (૫૦ + ૫૦ મીટર દોડ)

ગ્રુપ-૩	બાળકો ઉંમર વર્ષ ૭ થી ૯	રમત (૧)	જોડીની રમત રીલે રેસ
જન્મ તારીખ	૧-૧-૯૫ થી ૩૧-૧૨-૯૭		૧૦૦ + ૧૦૦ મીટર
રમત (૧)	૫૦ + ૫૦ ફોગ જમ્પસ	રમત (૨)	વિધ્ન દોડ ૧૫૦ મીટર
રમત (૨)	લીંબુ ચમચો ૨૫ મીટર	રમત (૩)	જોડીની રમત બોલ સાથેની ૫૦
રમત (૩)	શર્ટ પહેરવાની રમત		મીટર ત્રિપગી દોડ
	(સ્કુલનું બટનવાળું શર્ટ)	ગ્રુપ-૯	યુવકો ઉંમર વર્ષ ૧૭ થી ૨૪
ગ્રુપ-૪	બાલિકાઓ ઉંમર વર્ષ ૪ થી ૬	જન્મ તારીખ	૧-૧-૮૦ થી ૩૧-૧૨-૮૭
જન્મ તારીખ	૧-૧-૯૫ થી ૩૧-૧૨-૯૭	રમત (૧)	૪૦૦ મીટર દોડ
રમત (૧)	૫૦ + ૫૦ ફોગ જમ્પસ	રમત (૨)	વિધ્ન દોડ ૨૦૦ મીટર
રમત (૨)	લીંબુ ચમચો ૨૫ મીટર	રમત (૩)	લોગ જમ્પ
રમત (૩)	શર્ટ પહેરવાની રમત	રમત (૪)	હાઈ જમ્પ
	(સ્કુલનું બટનવાળું શર્ટ)	રમત (૫)	પૂટ શોટ
ગ્રુપ-૫	બાળકો ઉંમર વર્ષ ૧૦ થી ૧૨	ગ્રુપ-૧૦	યુવકો ઉંમર વર્ષ ૧૭ થી ૨૪
જન્મ તારીખ	૧-૧-૯૨ થી ૩૧-૧૨-૯૪	જન્મ તારીખ	૧-૧-૮૦ થી ૩૧-૧૨-૮૭
રમત (૧)	વિધ્ન દોડ ૧૫૦ મીટર	રમત (૧)	સ્મરણ શક્તિ
રમત (૨)	બટાટા રેસ ૫૦ મીટર	રમત (૨)	શાકભાજી શોધવાની રમત
રમત (૩)	બટરફ્લાય રેસ ૫૦ મીટર (પુકાની રમત)		યુવકો માટે ખુલ્લી હરીફાઈ
ગ્રુપ-૬	બાલિકાઓ ઉંમર વર્ષ ૧૦ થી ૧૨	ગ્રુપ-૧૧	(૨૫ વર્ષના ઉપરનાયુવકો)
જન્મ તારીખ	૧-૧-૯૨ થી ૩૧-૧૨-૯૪	જન્મ તારીખ	૩૧-૧૨-૭૮ પહેલાની
રમત (૧)	વિધ્ન દોડ ૧૫૦ મીટર	રમત (૧)	લોગ જમ્પ
રમત (૨)	બટાટા રેસ ૫૦ મીટર	રમત (૨)	હાઈ જમ્પ
રમત (૩)	બટરફ્લાય રેસ ૫૦ મીટર (પુકાની રમત)	રમત (૩)	પૂટ શોટ
ગ્રુપ-૭	કિશોરો વર્ષ ૧૩ થી ૧૬	રમત (૪)	રીલેરેસ ૨૦૦ + ૨૦૦ મીટર જોડીમાં
જન્મ તારીખ	૧-૧-૮૮ થી ૩૧-૧૨-૯૧	રમત (૫)	દોરડા ખેંચવાની રમત
રમત (૧)	જોડીની રમત રીલે રેસ	ગ્રુપ-૧૨	યુવતીઓ માટેની ખુલ્લી હરીફાઈ
	૧૦૦ + ૧૦૦ મીટર		(૨૫ વર્ષની ઉપરની યુવતીઓ)
રમત (૨)	વિધ્ન દોડ ૧૫૦ મીટર	રમત (૧)	જન્મ તારીખ ૩૧-૧૨-૯૮ પહેલાની)
રમત (૩)	જોડીની રમત બોલ સાથેની ૫૦		બેબી પાસ કરવાની રમત
	મીટર ત્રિપગી દોડ	રમત (૨)	૧૦૦ મીટર દોડ
ગ્રુપ-૮	કિશોરો વર્ષ ૧૩ થી ૧૬	આવશે)	
જન્મ તારીખ	૧-૧-૮૮ થી ૩૧-૧૨-૯૧	રમત (૨)	

ગ્રુપ-૧૩ પતિ-પત્નીની (કપલ ગેમ)
રમત (૧) મ્યુઝીકલ વોલીબોલ
રમત (૨) મેચીંગ ધી રીબન
રમત (૩) પાર્સીંગ ધી મેસેજ

સામાન્ય નીતિ નિયમો :

- (૧) ગ્રુપ નં.૧ થી ૮ ની હીટસ લેવામાં આવશે ગ્રુપ ૮માં સ્મરણ શક્તિની હીટસ નથી (આ ગ્રુપના તમામ હરીફોએ સવારે ૭-૩૦ કલાકે ગ્રાઉન્ડ ઉપર હાજર થઈ જવું. આ માટે અલગથી જાણ કરવામાં આવશે નહીં.)
- (૨) ગ્રુપ નં. ૯ થી ૧૩ની રમતોની હીટસ લેવામાં આવશે નહીં. ભાગ લેનાર તમામ હરીફોએ બપોરે ૧૧-૦૦ના કલાકે ગ્રાઉન્ડ પર હાજર થઈ જવું.
- (૩) ગ્રુપ નં. ૧૪ થી ૧૬ની રમતોની હીટસ લેવામાં આવશે નહીં. (વડીલો તથા મોટી બહેનોએ ૨-૦૦ વાગે હાજર રહેવું. આ રમતો ૩ વાગે શરૂ કરી દેવામાં આવશે.
- (૪) હરીફાઈમાં ભાગ લેનાર હરીફોએ પોતાની જવાબદારી સમજીને ભાગ લેવાનો છે. સંસ્થાની કોઈ જવાબદારી રહેશે નહીં.
- (૫) હરીફોએ પોતાના રજી પત્રકો સંપૂર્ણ વિગતો (વસ્તીપત્રક નંબર સાથે) સંસ્થાની ઓફિસમાં સમયસર મોકલી આપવા અધૂરા અરજી પત્રકો રદ કરવામાં આવશે. જન્મ તારીખ, વાલીની સહી, રમતનું ગ્રુપ વિગેરે વિગતો ભરવા વિનંતી છે.
- (૬) હરીફોની જન્મ તારીખ બાબતમાં દાખલો માંગવામાં આવે કો તે આપવાની જવાબદારી રહેશે. જેને માટે જન્મપત્રિકા (બર્થ સ્ટ્રીફીકેટ) માન્ય ગણાશે.
- (૭) ગ્રુપ ૧ થી ૮ સુધી હરીફોએ કેનવાસના બુટ પહેરવા વિનંતી.
- (૮) હરીફોએ વિજેતાઓ અંગેના નિર્ણય બાબતમાં

સંઘ તરફથી નક્કી કરવામાં આવેલા નિર્ણાયકોના નિર્ણય આખરી ગણાશે જે દરેક હરીફોને બંધનકર્તા રહેશે.

- (૯) સીંગલ્સ હરીફાઈના આઠ હરીફોના અરજી પત્રકો તથા જો ડીવાળા હરીફાઈમાં સોળ અરજીપત્રકો હશે તો જ હરીફાઈ યોજવામાં આવશે અથવા તે રમતો રદ ગણાશે.
 - (૧૦) બીજા કોઈપણ નીતિ નિયમો જરૂર જણાતા હરીફાઈના સમયે રમતગમત સમિતિ તરફથી જણાવવામાં આવતા તેનું પાલન કરવાનું રહેશે.
 - (૧૧) પરાં વિભાગના હરીફોએ અરજી પત્રકો સ્થાનિક સંચાલકો પાસેથી મળી શકશે અને તેઓ આખર દિવસના ૪ દિવસ અગાઉ સંચાલકોને અથવા સંસ્થાની ઓફિસથી સમય મર્યાદામાં પહોંચતાં કરવાના રહેશે.
 - (૧૨) દરેક અરજીપત્રક બોલપેન અથવા ઈન્ડીપેનથી ભરવું જરૂરી છે.
 - (૧૩) હીટના વિજેતાઓ તથા તેમના વડીલો માટે જમવાની વ્યવસ્થા રાખવામાં આવી છે.
 - (૧૪) રમતગમત કાર્યક્રમમાં, ફેરફાર કરવાનો અધિકાર બાહ્ય રમતગમત સમિતિના સંચાલકોનો રહેશે. જે બદલ કોઈ ફરિયાદ ચાલશે નહીં.
- અમે આ આશા રાખીએ છીએ કે ઉપરોક્ત વિવિધ રમતોમાં બાલાસિનોરના ઉત્સાહી બાળકો-બાળકીઓ, કિશોરો-કિશોરીઓ, યુવક-યુવતિઓ, વડીલો-મોટી બહેનો સર્વે ભાગ લઈ રમતોને જવલંત અને રસમય બનાવશો.

આ સૌ બાલાસિનોર વાસીઓ વિશાળ સંખ્યામાં હાજર રહી હરીફોનો ઉત્સાહ વધારશે. અને ૩૪માં રમતગમતોત્સવને સફળ બનાવશો એવી અપેક્ષા.

મંત્રી:- પ્રદીપ કડકીયા

સંયોજક:- પરેશ ન. ધારીઆ (દાઉટીયા)

પ્રકીર્ણ વિભાગ




નવા સરનામાં

- ૧) Rajesh Natwarlal Kadakia
3531, St. Anne's CT
AURORA IL 60504 USA
Ph (R) 630-947-7911 (Mob) 630-709-5485
- ૨) ભરત નટવરલાલ કડકીઆ
૧૩૦૧, કીસન્ટ હાઈટસ, ફોરજેટ સ્ટ્રીટ,
તારદેવ, મુંબઈ - ૪૦૦ ૦૩૬
ફોન:૨૩૮૮૯૮૭૦ મોબાઈલ:૯૮૨૦૧૪૧૮૬૫
- ૩) રાહુલ શશીકાંત ધારીઆ
૪/૯૦૩, ગોલ્ડન રે બીલ્ડીંગ,
શાસ્ત્રી નગર, લોખંડવાલા કોમ્પ્લેક્ષની પહેલા,
અંધેરી (વેસ્ટ), મુંબઈ - ૪૦૦ ૦૫૩
ફોન : ૨૩૦૨૩૭૯, ૨૦૫૬૩૦૨૩
- ૪) શ્રીકાંત બાબુલાલ પરીખ (રોકડીઆ)
લક્ષ્મી વિહાર, રજે માળે, બ્લોક નંબર-૫/બી,
વાલકેશ્વર રોડ, રાજભવન ગેટની બાજુમાં,
મુંબઈ - ૪૦૦ ૦૦૬
ફોન : ૨૩૬૮૫૬૯૯
- ૫) વસંત નટવરલાલ મોદી
૨૫૦, વી.પી.રોડ, પ્રાર્થના સમાજ, હેન્દ્રે બિલ્ડીંગ,
૩ જે માળે, રૂમ નંબર - ૩૧,
મુંબઈ - ૪૦૦ ૦૦૪
- ૬) પ્રકાશ મણીલાલ મોદી (ચેપ)
એ-૪, ત્રીવેણી, ૬૬, વાલકેશ્વર રોડ
મુંબઈ - ૪૦૦ ૦૦૬

- ફોન:૨૩૬૩૧૨૮૮, ૩૦૯૨૫૭૬૬, ૫૬૬૪૩૪૯૯
મોબાઈલ : ૯૮૨૦૦૫૨૪૫૧
- ૭) જીગ્નેશ એમ. કડકીઆ
૧૫૫/એ, આદીનાથ સોસાયટી,
વિ.આય.પી.રોડ, બ્રાઈટ સ્કુલની પાસે,
કારેલી બાગ, વડોદરા - ૨૨
 - ૮) શૈલેષ નટવરલાલ ગાંધી
૫-૩-૯૫ જીરા, રજે માળે,
ફ્લેટ નંબર - ૨૦૨,
સીકન્દ્રાબાદ - ૫૦૦ ૦૦૩
ફોન:૨૭૫૩૩૩૮૫
મોબાઈલ: ૯૮૪૯૭૨૦૮૯૯
 - ૯) હેમંત આર. શાહ
એ/૨૦૨, મહાત્મે પ્લાઝા
બીજે માળે, દહાણુકર વાડી,
એમ.જી.રોડ, કાંદીવલી (વેસ્ટ)
મુંબઈ - ૪૦૦ ૦૬૭
 - ૧૦) પ્રવીણચંદ્ર મણીલાલ મોદી
એક્શન ફોર મેન, ૭ હાથીવાલા બીલ્ડીંગ
રોડ નંબર - ૩, દૌલતનગર, બોરીવલી (ઈસ્ટ),
મુંબઈ ફોન : ૫૬૦૨૩૯૫૬
 - ૧૧) દીપેન કીરીટ દેસાઈ
કીરીટ ઓ. દેસાઈ (સેવાલીયાવાળા)
એ/૦૩, લીજજત ગોદાવરી સોસાયટી,
ગ્રાઉન્ડ ફ્લોર, વિનાયક નર્સીંગ હોમની પાસે,
એમ.જી.રોડ, કાંદીવલી (વેસ્ટ), મુંબઈ - ૬૭
ફોન : ૨૮૦૨૦૩૨૧
 - ૧૨) Amit A. Mody
2604, TAGGERT DRIVE, BELL MEAD,
N.J. - 08502 U.S.A.
PH : 908 359 -1843

૧૩) Hemal G. Mody
28, Meander Lane,
Levitowne, L.I. 11756,
N.Y. - U.S.A.
- Ph : 516 - 520 - 0101

૧૪) શૈલેષ કીર્તનલાલ દેસાઈ
મીલીન્દ શૈલેષ દેસાઈ (ભારત કોરપો.)
૪૧, દેવાછાયા, હાજીઅલી સર્કલ,
મુંબઈ - ૩૪ ફોન : ૩૦૯૦૮૧૫૧



નવા ફોન નંબર



- ૧) પ્રદીપ પ્રવીણચંદ્ર કડકીઆ
ફોન : ૯૮૧૯૩૮૯૪૮૪
- ૨) પ્રવીણચંદ્ર મોહનલાલ શાહ
ઘર: ૫૬૬૪૩૭૭૩

અભિનંદન

- ૧) પ્રવીણચંદ્ર લલ્લુભાઈ પરીખ (રોકડીયા)ની નીમણુંક પી.જી.હિન્દુ જીમખાનામાં માનદ્ પજાનચી તરીકે થઈ છે તે બદલ તેઓને અભિનંદન.
- ૨) શ્રી ભાવીન ગુણવતંભાઈ કડકીઆની નીમણુંક S.E.O. તરીકે કરવામાં આવી છે તથા તેઓ ઈન્ડીયન મર્ચન્ટ એમ્બરના ઈન્ફોમેશન ટેકનોલોજી સેલના એકઝ્યુકીટીવ ડીરેક્ટર નીમાયા છે. તે બદલ તેઓને અભિનંદન.
- ૩) શ્રી નવીનભાઈ જે. શાહ (બરોડાવાળા)ની બોરીવલી ખાતે સ્થપાયેલ પ્લેનેટોરીયમ ના ટ્રસ્ટી તરીકે કરવામાં આવી છે આ પ્લેનેટોરીયમની સ્થાપના ધ

ઈન્ડીય પ્લેનેટરી સોસાયટી દ્વારા કરવામાં આવી છે. આ પ્લેનેટોરીયમ મોબાઈલ છે અને વિવિધ સ્થળોએ ફેરવી ને વિદ્યાર્થીઓની અનંત ભ્રમ્માંડને જોવાની ભૂખ સંતોષ શકે છે. શ્રી નવીનભાઈનેઆ નીમણુંક બદલ ધન્યવાદ.

પાનખરમાં સુખી થવું હોય તો...

- ૧) જરૂર પુરતું જ બોલવું.
- ૨) દિકરા કે વહુને વણમાગી સલાહ કે માર્ગદર્શન આપવું નહીં.
- ૩) તમારા અતિતને ભૂલી વર્તમાનને નજર સમક્ષ રાખો.
- ૪) મારું ધાર્યું મને ગમે તેવું જ થાય તેવો હઠાગ્રહ રાખશો નહીં.
- ૫) બિનજરૂરી ખોટા વ્યવહારો ઉભા કરી દિકરાને ખોટા ખર્ચમાં ઉતારશો નહીં.
- ૬) તમારી બધી મિલકત છોકરાઓને આપશો નહીં.
- ૭) સમયસર જમી, બાકીના સમયમાં ધાર્મિક પુસ્તકો વાંચવા અગર મંદિર, મહાદેવમાં જઈ સત્સંગ કરવો.
- ૮) બિનજરૂરી વાતો અને નિંદાથી દૂર રહેવું.
- ૯) દિકરા સાથે એક હિતચિંતક મિત્ર જેવો અને પુત્રવધુ સાથે દિકરી જેવો વ્યવહાર કરવો.
- ૧૦) સગવડ હોય ત્યાં એક જૂલો વસાવી લેવો અને સમય મળે પૌત્રને જૂલે બેસી રમાડતા હરિસ્મરણ કરવું.
- ૧૧) પુત્રવધુ આગળ તેના બા-બાપુજી એટલેકે વેવાઈ વેવાણના વખાણ કરવા.
- ૧૨) અને છેલ્લે, ફાવશે, ગમશે અને ભાવશે આ વાતોને જીવનમાં વણી લેવી.

બાલાસિનોર વાસીઓની સગવડ માટે વધુ એક પ્રયાસ જયોતિપુંજના પ્રકીણ વિભાગ માટે

E-mail Address - vadsol@balasinor.org



શ્રી બાલાસિનોર નવચુવક સંઘ સંચાલિત
શ્રીમતી મંજુલાબેન શાંતિલાલ મહેતા (ધરીવાળા) પુસ્કૃત
કોમ્પ્યુટર શિક્ષણ યોજના

આ યોજનામાં સ્કુલમાં અને કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓ, ગૃહિણિઓ, સીનીયર સીટીઝન આનો લાભ લઈ શકશે. આ યોજનામાં WINDOWS, MSDOS, MS OFFICE, INTERNET અને EMAIL શીખવાડવામાં આવશે.

આ પ્રવૃત્તિ માટે નીચે મુજબ જણાવેલ સંસ્થાઓ સાથે મળીને આનો લાભ દરેક મુંબઈ તથા પરામાં રહેતા લોકોને આપવાનું વિચાર્યું છે.

- 1) Software academi - Parekh Wadi, Mumbai - 400 004 Tel : 23814915
- 2) Kesar Computer Classes - Malad (W), Ph : 28811231
- 3) Plus Point Infotech (P) Ltd. ના સેન્ટરો

Kandivali (w) ઈ : 2884 1151 ઈ : 2885 6174

Dahisar (E) ઈ : 2894 0919 Virar (W) ઈ : 95250-2510193

Sterlite Foundation ના સેન્ટરો

- | | | |
|-----------------------|---------------------|-------------------|
| (1) Andheri (W) | (2) Bhayander(W) | (3) Dombivali (E) |
| (4) Dahisar | (5) Goregaon (W) | (6) Lower Parel |
| (7) Mira Road (E) | (8) Marine Line | (9) Matunga(E) CR |
| (10) Sion | (11) Vile Parle (E) | (12) Worli |
| (13) Worli (Sea Face) | | |

આ યોજના માટે સંસ્થામાં આનું ફોર્મ ભરવું જરૂરી રહેશે, ફોર્મની સાથે રૂ. ૭૫૦/- રોકડા અથવા ચેક અને એક ફોટો આપવાનો રહેશે. સફળતા પૂર્વક કોર્સ પુરો કરી, સર્ટિફિકેટ મેળવનાર વિદ્યાર્થીને રૂ. ૫૦૦/- ચેકથી પાછા આપવામાં આવશે.

આ અંગેના ફોર્મ સંસ્થાની ઓફિસે સંસ્થાના સમય દરમ્યાન તથા સંયોજક શ્રી સમીર જયેન્દ્ર ગાંધી (લુહારચાલ) તથા પ્રમુખશ્રી અસીત દેસાઈ (Impex Agency) - Nagdevi થી મળશે.

આ અંગેની વધુ જાણકારી માટે સંયોજક સમીર જ. ગાંધીનો સંપર્ક સાધવો.

Samir Jayendra Gandhi

Tel : (O) 22060294 / 22038077 (R) 23879098

Nikoshi Trading Co., Room No. 12/5 1st floor, Carmellos building,
63/67 Pathak wadi, Lohar Chawl, Mumbai - 400 002.

મંત્રી - પ્રદીપ કડકીયા, સંયોજક : સમીર ગાંધી